

પ્રેરિતો

◆પિતર : તે સીમોન તરીકે પણ ઓળખાય છે. તેનું નામ બદલીને “કેફા” કરવામાં આવ્યું જેનો અર્થ “ખડક” થાય છે. તેણે યહૂદીઓ મધ્યે કામ કર્યું અને તેણે ૧ પિતર અને ૨જો પિતરના પત્રો લખ્યા. તેણે માર્કની સુવાર્તા લખવામાં પણ સહાયતા કરી હતી.

◆આંદ્રિયા : તે પિતરનો ભાઈ હતો અને તે પિતરને ઈસુ પાસે લાવ્યો હતો. (યોહ.૧:૪૦-૪૨). બંને ભાઈઓ બેથસૈદાના માછીમારો હતા.

◆યાકૂબ : તે યોહાનનો ભાઈ હતો. તેઓ બંને ઝબ્દી અને સાલોમીના દીકરા હતા અને પિતાની સાથે બેથસૈદામાં કામ કરતાં હતા. કોઈવાર “મહાન” કહેવાતા. યાકૂબે યરૂશાલેમ અને યહૂદિયામાં પ્રચાર કર્યો. હેરોદ દ્વારા તેનો વધ કરવામાં આવ્યો અને તે પ્રથમ શાહિદ થયો.

◆યોહાન : તે યાકૂબનો ભાઈ હતો. પિતાની જેમ બંને માછીમારો હતા(માર્ક ૧:૧૯-૨૦) ઈસુ આ બંનેભાઈઓને “વીજળીના દીકરા” કહે છે.(માર્ક ૩:૧૭). યોહાન ખાસ કરીને એશિયા માઇનોરની મંડળીઓમાં કામ કરતો હતો અને ખાસ કરીને એફેસસમાં કામ કરતો. ઇ.સ.૯૫માં તેણે તેને પાત્મસ બેટમાં બંદિવાસમાં મોકલવામાં આવ્યો. ત્યાં તેણે પ્રકટીકરણની નોંધ કરી. તેના લખાણોમાં યોહાનની સુવાર્તા અને ૧,૨,૩ પત્રો પણ છે.

◆ફિલિપ : તે બેથસૈદાનો હતો. તેણે નથાનિયેલને ઈસુ વિષે કહ્યું.

◆બર્થોલામી :કદાચ તે નથાનિયેલ હતો જેની વાત યોહાન ૧: ૪૪-૪૬માં મળે છે. તે ગાલીલના કાના ગામનો હતો.

પ્રેરિતો ઈશ્વરના ખાસ સંદેશવાહકો હતા. પ્રભુ તેમને તેના જીવન અને પુનરુત્થાન વિષે સાક્ષી આપવા માટે નિયુક્ત કરતો હતો. યહૂદા ઈશ્કારિયોતનું સ્થાન જ્યારે ભરવામાં આવ્યું ત્યારે નવો પ્રેરિત ઈસુની જગતની સેવા દરમિયાન ઈસુ તથા શિષ્યો સાથે હોવો જોઈએ (પ્રે.કૃ.૧:૨૧) પાછળથી ખ્રિસ્તે પાઉલને વિદેશીઓના પ્રેરિત થવા માટે દર્શન દીધું. (૧કરિ.૧૫:૮) અહીં આપેલી કેટલીક માહિતી Frank L. Cox, “The Glorious Company of the Apostles,” *The Minister’s Monthly* (February 1960): 254.માંથી લેવામાં આવી છે.

પ્રેરિતો (યાલુ)

- ◆ થોમા : તે દીદુમસ “જોડિયો” કહેવાતો હતો (યોહ.૧૧:૧૬, ૨૦:૨૪, ૨૧:૨) તેનું વતન ગાલીલ હતું. સિરિયાના વિશ્વાસીઓના માટે દેશની મંડળીનો સ્થાપક હતો. તેણે પર્સિયા અને ભારતમાં પણ મંડળીઓની સ્થાપના કરી હશે.
- ◆ માથ્થી: તે અલ્ડીના દીકરા લેવી તરીકે પણ જાણીતો હતો. (માથ.૯:૯; માર્ક૨:૪) તે કાપરનાહૂમનો હતો અને રોમન સરકારમાં કર-અધિકારી હતો.
- ◆ યાકૂબ: તેને ઘણી વાર “ઊણો” પણ કહેવામા આવતો તે અલ્ડી અને મરિયમનો દીકરો હતો (માથ.૧૦:૩, ૨૭:૫૬) (શું માથ્થી અને યાકૂબ ભાઈઓ હતા? આપણે તે જાણતા નથી.) તે ગાલીલનો હતો અને યાકૂબના પત્રનો લેખક પણ છે.
- ◆ થાદી તે યાકૂબનો દીકરો હતો(માથ.૧૦:૩, લૂક ૬:૧૬) અને તેને યહૂદા કે યહૂદ પણ કહેતા. તે ગાલીલનો હતો.
- ◆ સીમોન ઝલોટસ: તે કાનારિયન તરીકે પણ જાણીતો હતો (ઝલોટસનો બીજો શબ્દ) તે અરામી ભાષાનો શબ્દ છે. તે ગાલીલનો હતો.
- ◆ યહૂદા ઈશ્કારિયોત: “ઈશ્કારિયોત” શબ્દ બતાવે છે કે તે યહૂદાના કેરીઓથનો રહેવાસી હતો. તેણે ઈસુને પરસ્વાધીન કર્યા અને પછી આત્મહત્યા કરી.
- ◆ માથ્થિયાસ :યહૂદાના મરણ પછી તેના સ્થાને મત લઈને લેવામાં આવ્યો. (પ્રે.કૃ.૧:૨૬) પ્રે.કૃ.૧:૨૨ પરથી જાણવા મળે છે કે તે ઈસુના બાપ્તિસ્માથી તેઓની સાથે હતો અને ઈસુના ઊંચકાઈ જવા સુધી સાથે રહ્યો હતો.
- ◆ પાઉલ: શાઉલ જે પાછળથી પાઉલ કહેવાયો તે મંડળીનો સતાવનારો હતો પણ તેને પાછળથી વિદેશીઓના પ્રેરિત તરીકે ખાસ પસંદ કરવામાં આવ્યો. (રોમ.૧૧:૧૩, ૧ કરિં.૯:૧, ૧૫: ૯, ૨ કરિં. ૧૨:૧૨, ગલ.૧:૧, તિમ.૨:૭) તે દમસ્કના માર્ગે ઈસુને મળ્યો અને નવા કરારનો મોટા ભાગનો હિસ્સો તેણે લખ્યો છે.